

બિઝનેસ લોન ડ્રોપ-લાઇન ઓવરડ્રાફ્ટ

Version 3 / 2012.02



BUSINESSLOAN
HDFC BANK
We understand your world

અરજી ફોર્મ

ક્રમ નં.:

સોર્સિંગની વિગતો

CRMNext/LTS નં. _____ સેલ્સ પ્રોમો કોડ _____ લીડ જનરેટર _____ ફિનવેર બ્રાન્ચ કોડ _____
 DSA-DSA નામ, હોય તો _____ DSA વિકેતા કોડ _____
 સોર્સિંગ અધિકારીઓ SE કોડ _____ TSE કોડ _____ TL કોડ _____
 SM કોડ _____ ટાઇઅપ્સનું નામ _____
 પેટા સોર્સ (કૃપા કરીને કોઈ એક પર વર્તુળ કરો) LTS / OPN / XSL / ATM / SMS / TEL / PBK / INW / ENW / CCP / NET / NCQ / COP / EML / CHT / CLK / BBZ / OTH

લોન વિગતો

લોન માટે કરેલી અરજી રૂ. _____ લોનનો સમયગાળો (માસ) _____
 પ્રવર્તમાન લોન રકમ (રૂ.) _____ પ્રવર્તમાન લોન એકાઉન્ટ નં. _____
 લોનનો હેતુ
☐ કૃષિ/કાર્મિંગ ☐ ડેરી/કુકર પાલન/મરઘા પાલન/મધમાખી ઉછેર ☐ સિંચાઈ/વાવણી/છંટકાવ/લણણી/વર્ગીકરણ/જુદું પાડવું
☐ કૃષિ પેદાશોનું પરિવહન ☐ આહાર પ્રસંસ્કરણ એકમ ☐ ખાતર, જંતુનાશક, બિયારણ વગેરેમાં વેપાર
☐ કોલ્ડ સ્ટોરેજ/વેરહાઉસ ☐ આડતિયા/કમિશન એજન્ટ ☐ વ્યવસાયનું વિસ્તરણ
☐ કાર્યકારી મૂડી જરૂરિયાત ☐ વેપાર પરિસરની ખરીદી/મરામત ☐ ઉપકરણો/સાધનોની ખરીદી/મરામત
☐ હોમ રિનોવેશન ☐ કમ્પ્યુટર/ઓફિસ ફર્નિચર ☐ શિક્ષણ
☐ લગ્ન ☐ પ્રવાસ ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) _____

વ્યક્તિગત

શિર્ષક: ☐ અરજદાર ☐ સહ-અરજદાર
☐ શ્રીમાન ☐ શ્રીમતિ ☐ ડો. ☐ અન્ય
 અરજદારનું નામ _____
 પિતા/પતિનું નામ _____ પ્રથમ નામ _____ પિતા/પતિનું નામ _____ અટક _____
 જન્મ તારીખ _____ જાતિ ☐ પુરુષ ☐ સ્ત્રી ☐ ત્રીજી જાતિ _____
 પાન કાર્ડ નં. _____ કયા વર્ષથી ITR દાખલ કરવામાં આવ્યું છે _____
 વૈવાહિક દરજ્જો ☐ પરણિત ☐ અપરણિત ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) _____ નાણાકીય આશ્રિતો _____
 વર્તમાન સરનામું (રહેણાંક) _____
 પ્રખ્યાત સ્થળ _____
 શહેર _____
 રાજ્ય _____
 દેશ _____
 પિનકોડ _____
 સંપર્ક વિગતો _____ દેશનો કોડ _____ STD _____
 દેશનો કોડ _____ શોન-1 _____
 મોબાઇલ _____
 ઈ-મેઇલ _____
 કાયમી સરનામું (રહેણાંક) _____
 પ્રખ્યાત સ્થળ _____
 શહેર _____
 રાજ્ય _____
 દેશ _____
 પિનકોડ _____
 સંપર્ક વિગતો _____ દેશનો કોડ _____ STD _____
 તબક્કો-1 _____ શોન-2 _____
 મોબાઇલ _____
 ધર્મ _____ રાષ્ટ્રીયતા _____ શ્રેણી ☐ SC ☐ ST ☐ OBC ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) _____
 શારીરિક રીતે દિવ્યાંગ ☐ હા ☐ ના

કૃપા કરીને અહીં તમારો કોટી ચોટાડો અને તેની ઉપર હસ્તાક્ષર કરો

હું આથી જાહેર કરું છું કે ઉપરોક્ત પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી અને સચોટ છે.

ગ્રાહકની સહી

વ્યક્તિગત

વર્તમાન રહેણાંકમાં થયેલા વર્ષ વર્તમાન રહેણાંકમાં થયેલા વર્ષ શહેરમાં થયેલા વર્ષ

રહેણાંકનો પ્રકાર ☐ માલિકી ☐ માતા/પિતાની માલિકી ☐ ભાડે પ્રતિ માસ રૂ.

શૈક્ષણિક લાયકાત ☐ ઉપરનાતક ☐ સ્નાતક ☐ અનુસ્નાતક ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો)

સ્વ-રોજગાર વ્યાવસાયિક ☐ ડોક્ટર ☐ CA ☐ CS ☐ MBA ☐ એન્જિનિયર

તજજતા (જો કોઈ હોય તો)

પસંદગીનું સંદેશ વ્યવહારનું સરનામું

☐ વર્તમાન રહેણાંક ☐ કાયમી રહેણાંક ☐ ઓફિસ

વ્યવસાય વિગતો

પેઢી/કંપનીનું નામ

પેઢી/કંપનીનું સરનામું

પ્રખ્યાત સ્થળ

શહેર

રાજ્ય

દેશ

પિનકોડ

દેશનો કોડ

સંપર્ક વિગતો STD ડોન-1 Ext.

ડોન-2 Ext.

મોબાઇલ ☐ કૃપા કરીને SMS મારફતે બેન્ક તરફથી સંદેશ વ્યવહાર મેળવવા ટિક કરો

ફેક્સ નં. વેબસાઇટ

ઈ-મેઇલ

☐ કૃપા કરીને ઈ-મેઇલ મારફતે બેન્ક તરફથી સંદેશ વ્યવહાર મેળવવા ટિક કરો

પેઢી /કંપની નોંધાયેલું સરનામું

પ્રખ્યાત સ્થળ

શહેર

રાજ્ય

દેશ

પિનકોડ

દેશનો કોડ

સંપર્ક વિગતો STD ડોન-1 Ext.

ડોન-2 Ext.

ફેક્સ નં. વેબસાઇટ

GST No.:

બંધારણ ☐ એકલ માલિકી ☐ ભાગીદારી ☐ ખાનગી લિમિટેડ કં. ☐ અન્ય (કૃપા સ્પષ્ટ કરો)

વ્યવસાયનો પ્રકાર ☐ ઉત્પાદન ☐ ટ્રેડિંગ/ચૂટક વેચાણ/જથ્થાબંધ વેચાણ ☐ સેવા પ્રદાતા ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો)

ઉદ્યોગનો પ્રકાર ☐ રિયલ એસ્ટેટ એજન્ટ/બિલ્ડર ☐ સ્ટોક બ્રોકર ☐ કૃષિવિદ/ખેડૂત ☐ પાન નં.

સમાવેશ કર્યાની તારીખ વ્યવસાયમાં કુલ વર્ષ વર્તમાન વ્યવસાયમાં કુલ વર્ષ

વ્યવસાયનું પરિસર ☐ માલિકીની ☐ ભાડાની ચુકવવામાં આવતું ભાડું રૂ. દર મહિને

નાણાકીય/આવકની વિગતો

વાર્ષિક આવક રૂ. વધારાની આવક રૂ. ☐ ભાડેથી ☐ કૃષિ ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો)

તમે HDFC બેંક સાથે બેન્કિંગ કરો છો ☐ હા ☐ ના

મેળવેલી સુવિધાનો પ્રકાર	એકાઉન્ટ નં./કાર્ડ નં.	લોન રકમ/ડિપોઝિટ	માસિક હસા	કેટલા વર્ષથી સંબંધ છે	બેન્કનું નામ
પ્રવર્તમાન લોન-1					
પ્રવર્તમાન લોન-2					
પ્રવર્તમાન લોન-3					
ક્રેડિટ કાર્ડ					
ચાલુ/બચત/ટર્મ ડિપોઝિટ					

કૃપા કરીને તમારા પ્રાથમિક બેન્કરની માહિતી આપો

બેન્કનું નામ

એકાઉન્ટ નં.

માલિકીની મિલકતો ☐ કાર ☐ ટૂ-વ્હીલર ☐ કમ્પ્યુટર ☐ બાંજર ☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો)

કૃપા કરીને તમે અત્યારે માલિકી ધરાવતાં હોય તે વાહનની વિગતો આપો

વાહનની કંપની/મોડલ

નોંધણી નં.

કોના દ્વારા ધીરાણ કરાયું

ઉત્પાદનનું વર્ષ

પેઢી /કંપની
નોંધાયેલું સરનામું

પ્રખ્યાત સ્થળ

શહેર

રાજ્ય

દેશ

પિનકોડ

દેશનો કોડ

સંપર્ક વિગતો

STD

ફોન-1

Ext.

ફોન-2

Ext.

મોબાઈલ નં.

☐ કૃપા કરીને SMS મારફતે સંદેશા વ્યવહાર મેળવવા ટિક કરો.

ફેક્સ નં.

વેબસાઈટ

W W W

ઈ-મેઈલ

☐ કૃપા કરીને ઈ-મેઈલ મારફતે સંદેશા વ્યવહાર મેળવવા ટિક કરો.

નોંધાયેલા સરનામે વિતાવેલા વર્ષોની સંખ્યા

બંધારણ

☐ એકલ માલિકી

☐ ભાગીદારી

☐ ખાનગી લિમિટેડ કંપની

☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) _____)

વ્યવસાયનો પ્રકાર

☐ ઉત્પાદન

☐ ટ્રેડિંગ

☐ સેવાઓ

ઉદ્યોગનો પ્રકાર

પાન નં.

સંસ્થાપનની તારીખ

વ્યવસાયમાં થયેલા કુલ વર્ષો

વર્તમાન વ્યવસાયમાં વિતાવેલા કુલ વર્ષો

વ્યાવસાયિક પરિસરો

☐ માલિકીનું

☐ ભાડે

ચુકવવામાં આવતું ભાડું રૂ.

પ્રતિ માસ

માલિક /ભાગીદારો/ડિરેક્ટર્સની વિગતો

માલિક/ભાગીદારો/ ડિરેક્ટર્સના નામ	માલિક/ભાગીદારો/ડિરેક્ટર્સના સરનામા (કૃપા કરીને શહેર, રાજ્ય અને પિનકોડ સ્પષ્ટ કરો)	માલિક/ભાગીદારો/ડિરેક્ટર્સની સંપર્ક વિગતો	ઉંમર (વર્ષમાં)	શિક્ષણ પૃષ્ઠભૂમિ	નફાની વહેંચણી/ શેરહોલ્ડિંગ %	કુલ અનુભવ (વર્ષોમાં)

નાણાકીય/આવકની વિગતો

ચોખ્ખો નફો (રૂ.)

વાર્ષિક ટર્નઓવર (રૂ.)

તમે HDFC બેંક સાથે બેન્કિંગ કરો છો

☐ હા

☐ ના

મેળવેલી સુવિધાનો પ્રકાર	એકાઉન્ટ નં./કાર્ડ નં.	લોન રકમ/ડિપોઝિટ	માસિક હસા	કેટલા વર્ષથી સંબંધ છે	બેન્કનું નામ
પ્રવર્તમાન લોન-1					
પ્રવર્તમાન લોન-2					
પ્રવર્તમાન લોન-3					
ક્રેડિટ કાર્ડ					
ચાલુ/બચત/ટર્મ ડિપોઝિટ					

કૃપા કરીને તમારા પ્રાથમિક બેન્કરની માહિતી આપો

બેન્કનું નામ

એકાઉન્ટ નં.

માલિકીની મિલકતો

☐ કાર

☐ ટૂ-વ્હીલર

☐ કમ્પ્યુટર

બ્રાન્ચ

કેટલા વર્ષોથી એકાઉન્ટ ધરાવો છો

☐ મિલકત

☐ અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) _____

કૃપા કરીને તમે અત્યારે માલિકી ધરાવતાં હોય તે વાહનની વિગતો આપો

વાહનની કંપની/મોડલ

ઉત્પાદનનું વર્ષ

નોંધણી નં.

કોના દ્વારા ધીરાણ કરાયું

સંબંધ

(અન્ય બેન્કની સાથે અરજદારના સંબંધની વિગતો)

અરજદાર કોઈ બેન્કના ડિરેક્ટર છે અથવા તેવી પેઢી છે જેમાં કોઈ ડિરેક્ટર ભાગીદાર/ગેરેન્ટર તરીકે હિત ધરાવે છે અથવા અન્ય બેન્કોના ડિરેક્ટર્સના સંબંધી છે અથવા તેવી પેઢી છે જેમાં ડિરેક્ટર્સના સંબંધીઓ ભાગીદાર અથવા ડિરેક્ટર તરીકે હિત ધરાવે છે.

હા ☐ ના ☐ સંબંધનો પ્રકાર

(ધીરાણ કરતી બેન્ક સાથે અરજદારના સંબંધની વિગતો)

અરજદાર બેન્કના ડિરેક્ટર/વરિષ્ઠ અધિકારી/ડિરેક્ટર અથવા વરિષ્ઠ અધિકારીના સંબંધી છે.

હા ☐ ના ☐ સંબંધનો પ્રકાર

વધારાની માહિતી

● ચુકવણી: લોન અરજીની પ્રક્રિયા કરવા માટે તમારી પાસેથી અગ્રીમ ચુકવણી તરીકે કોઈ રોકડ/ ધારણકર્તા ચેક મેળવવામાં આવ્યો નથી. ● ડિસ્કાઉન્ટ/ ફી ગિફ્ટ અથવા અન્ય કોઈપણ પ્રકારનું વધન જેનો ઉલ્લેખ HDFC બેન્ક અથવા તેના કોઈ અધિકૃત પ્રતિનિધી(ઓ) દ્વારા લોનના કરારમાં કરવામાં આવ્યો નથી તેને ધ્યાન ઉપર લેવામાં આવશે નહીં. ● મહત્તમ ઓવરડ્રાફ્ટ મર્યાદા અને લોન રકમનું વિતરણ એકમાત્ર HDFC બેન્કની વિવેકબુક્કીને આધીન છે અને આ સંબંધે કોઈ વચન આપવામાં આવ્યું નથી. – અરજી ઉપર પ્રક્રિયા અને ઓવરડ્રાફ્ટ સુવિધાની ઉપલબ્ધતા: બેન્કના નિર્ધારિત માપદંડો અનુસાર તમામ સંબંધિત લોન દસ્તાવેજો પૂર્ણ કરવા અને જમા કરાવવાના સમયથી આશરે કામકાજના 10 દિવસો લાગી શકે છે. – વ્યાજ દર અને અન્ય ચાર્જિસ: વ્યાજ દર પ્રતિ વર્ષ % છે અને પ્રોસેસિંગ ફી પૂરી પાડેલી લોન રકમના % રહેશે. સુવિધાની શરૂઆતની તારીખથી પ્રથમ છ માસની અંદર પ્રી-કલોઝર સુવિધા મેળવવાની પરવાનગી નથી. આ 6 મહિના બાદ સુવિધાના પ્રી-કલોઝર બદલ આવી તારીખના રોજ લાગુ પડતાં કુલ ઓપરેટિંગ ઓવરડ્રાફ્ટ ઉપર 4% ચાર્જ લાગુ પડશે. સુવિધાનું આંશિક કલોઝર માટે કુલ સુવિધાના સમયગાળા દરમિયાન પરવાનગી નથી. કુપ્લિકેટ નો ડ્યુ સર્ટિફિકેટ/ NOC માટે ચાર્જિસ રૂ. 250 [●] /- છે. ચુકવણમાં નહીં આવેલી રકમ (જે-તે માસ માટે સુવિધાની ઓપરેટિંગ મર્યાદા કરતાં વધારાનો મુખ્ય ચુકવણાપાત્ર બાકી રકમનો હિસ્સાની સાથે અન્ય ચુકવણમાં નહીં આવેલા બાકી રકમ) નાદારી, ચેક/SI/ECS રિટર્ન ચાર્જિસની તારીખથી બાકી રહેલી રકમ ઉપર 24% છે (અસ્વીકૃતિ બદલ બેન્કના દીવાની અને ફોજદારી અધિકારો અને ઉપાયોને વિપરિત અસર થયા વગર): 550/- પૂર્વ પ્રસંગ, કાનૂની અને પ્રાસંગિક ચાર્જિસ વાર્ષિક ધાર્ય છે મુજબ. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય વૈધાનિક ચાર્જિસ રાજ્યના લાગુ પડતાં કાયદા મુજબ. ● પ્રોડક્સના કોસ વેચાણ ઉપર ચાર્જિસ લાગુ પડશે, જો હોય તો.

તમારો એકરાર

(1) હું/અમે મારા/અમારા રહેઠાણ અથવા રોજગારના સરનામામાં થયેલા કોઈપણ ફેરફાર અંગે બેન્કને સૂચિત કરીશું. (2) હું/અમે તમારા દ્વારા મેળવવામાં આવેલી તમામ રકમો આ ખાતાના કોઈ એક નામે અથવા તમામ નામો પર જમા કરશો. (3) હું/અમે પુષ્ટિ કરીએ છીએ કે લોન સ્વરૂપે મેળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ જણાવેલા હેતુ માટે કરવામાં આવશે અને સહકારીય અથવા સમાજ વિરોધી હેતુ માટે કરવામાં આવશે નહીં. (4) હું/અમે પ્રમાણિત કરીએ છીએ કે હું/અમે ભારતના નાગરિક છું/છીએ. (5) હું/અમે HDFC બેન્ક લિમિટેડને મારી અરજીના સંબંધમાં કોઈપણ તપાસ હાથ ધરવા અધિકૃત કરીએ છીએ. (6) હું/અમે બેન્કને અધિકૃત કરીએ છીએ અને સંમતિ આપીએ છીએ કે બેન્ક પાસેથી મારા/અમારા દ્વારા મેળવવામાં આવેલી સુવિધાઓના સંદર્ભમાં મારા/અમારા દ્વારા અરજી કોર્મમાં પૂરી પાડવામાં આવેલી માહિતી/આપવામાં આવેલા/આપવામાં આવનાર સંબંધિત દસ્તાવેજો મને જાણ કર્યા વગર બેન્કની અન્ય શાખાઓ/પેટા-શાખાઓ/ગૌણ કંપનીઓ/કેડિટ બ્યુરો/રેટિંગ એજન્સીઓ, સેવા પ્રદાતાઓ, બેન્કો/નાણાકીય સંસ્થાઓ, સરકારી/નિયમનકારી સત્તામંડળો અથવા ત્રાહિત પક્ષકારોને KYC પ્રમાણીકરણ, ધીરાણ જોખમ વિશ્લેષણ અથવા બેન્ક પોતે યોગ્ય ગણે તેવા અન્ય સંબંધિત હેતુઓ માટે જાહેર કરી શકે છે. હું/અમે ગોપનીયતા અને સારાની ગુમતાનો અધિકાર જતો કરીએ છીએ. (7) જો મારી/અમારી અરજી નકારવામાં આવે તો અમે તેની સામે અપીલ કરવાનો કોઈ અધિકાર અબાધિત રાખતા નથી અને સ્વીકારીએ છીએ કે આપા ઇનકાર માટે બેન્કને કોઈ કારણ આપવાની જરૂર નથી. (8) HDFC બેન્ક લિમિટેડ આ અરજી સાથે જમા કરાવેલા ફોટોગ્રાફ અને દસ્તાવેજો જાળવી રાખવાના અધિકારો અબાધિત રાખે છે અને અરજદારને તે પરત કરવામાં આવશે નહીં. કોઈ અન્ય ધીરાણકર્તા/બેન્ક દ્વારા મારી સામે કોઈ દાવો પડતર નથી. (10) હું/અમે આ લોનને લાગુ પડતાં નિયમો અને શરતો મળી હોવા અંગે અને તે વાંચી તથા સમજી હોવા અંગે ખાતરી આપીએ છીએ અને સંમત થઈએ છીએ કે આ HDFC બેન્ક લિમિટેડ દ્વારા આ નિયમો અને શરતોમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે અને મને/અમને સુધારેલા નિયમો અને શરતો બંધનકર્તા રહેશે. (11) હું/અમે પ્રમાણિત કરીએ છીએ કે ઉપરોક્ત પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી અને સચોટ છે.

હું/અમે ☐ બેન્ક/ ☐ તેના એજન્ટ દ્વારા ટેલિફોન/મોબાઇલ/જનજમારફતે માર્કેટિંગના હેતુ માટે માહિતી/સેવાઓ વગેરે મેળવવા સંમતિ આપીએ છીએ/સંમતિ આપતાં નથી. હું/અમે સંમત થઈએ છીએ અને સ્વીકારીએ છીએ કે “ડૂનોટ કોલ”ની નોંધણી માટે માત્ર પ્રત્યક્ષ ટેલિફોન નંબર (બોર્ડ/ઓફિસ/કોર્પોરેટ/કર્મચારીઓનો સામાન્ય ટેલિફોન નંબર નહીં) જ સ્વીકારવામાં આવશે. હું/અમે અવગત છીએ કે નોંધણી કરાયા બાદ, હું/અમે નોંધણી માટેની વિનંતીની સરચાઈ ચકાસવા માટે બેન્ક તરફથી કોલ મેળવી શકીએ છીએ. હું/અમે પુષ્ટિ કરીએ છીએ કે મે/અમે એકરાર વાંચી અને સમજી લીધી છે, અને કોર્મ ઉપર પૂરી પાડવામાં આવેલી તમામ વિગતો સાચી અને ખરી છે.

મે/અમે અન્ય કોઈ બેન્કમાં બિઝનેસ લોન અથવા ડ્રોપ-લાઈન ઓવરડ્રાફ્ટ માટે અરજી કરી નથી.

અરજદાર/સહ-અરજદારનું નામરથળઅરજી તારીખ

અરજદાર/સહ-અરજદારનું હસ્તાક્ષર

પ્રાથમિક ક્ષેત્ર શ્રેણી

જો અરદાર નીચે પેડી કોઈપણ શ્રેણી સાથે સંબંધ ધરાવતો હોય તો હું/અમે બેન્કને ટિક કરો

- | | | |
|---|---|---|
| ☐ પ્રત્યક્ષ કૃષિ | : | કૃષિવિદ/ખેડૂત અને સંલગ્ન કૃષિલક્ષી પ્રવૃત્તિ જેવી કે કેરી, ડુકર પાલન, મરઘા ઉછેર, મસ્ત્ય પાલન, મધમાખી ઉછેર, પશુઓનો ઘાસચારો, મરઘા માટે આહાર, છોડરોપણ, બાગાયાત, ખાતર, જંતુનાશક, વિચારણા વગેરે |
| ☐ પરોક્ષ કૃષિ | : | કૃષિ મશિનરીમાં ખેડૂતો અને ડીલર્સને ટ્રેડર/બોરવેલ/અન્ય સાધનો કોન્ટ્રાક્ટ પર આપવાનું સેવા એકમ, ખોરાક અથવા કૃષિ પેદાશ પ્રસંસ્કરણ એકમો, ખાદી અને ગ્રામ ઉદ્યોગ (KVI ક્ષેત્ર) |
| ☐ છૂટક વેપાર | : | ખાનગી છૂટક વેપારીઓ – રૂ. 20 લાખ સુધીની ધીરાણ મર્યાદા ધરાવતાં/આવશ્યક ચીજ-વસ્તુઓમાં વેપાર |
| ☐ લઘુ ઉત્પાદન સાહસ | : | રૂ. 5 કરોડ સુધી પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ ધરાવતાં ઉત્પાદન એકમો |
| ☐ સુક્ષ્મ ઉત્પાદન સાહસ | : | રૂ. 25 લાખ સુધી પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ ધરાવતાં ઉત્પાદન એકમો |
| ☐ લઘુ સેવા સાહસો | : | સેવા સાહસો – (વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક) – સ્વ રોજગાર વ્યાવસાયિકો, લઘુ વ્યવસાય, રોડ/ પાણી પરિવહન સંચાલકો, નાના પાયા પર સેવા અને વ્યવસાય ચલાવતાં સાહસો રૂ. 2 કરોડ સુધી ઉપકરણોમાં રોકાણ સાથે. |
| ☐ સુક્ષ્મ સેવા સાહસો | : | સેવા સાહસો – (વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક) – સ્વ રોજગાર વ્યાવસાયિકો, લઘુ વ્યવસાય, રોડ/ પાણી પરિવહન સંચાલકો, નાના પાયા પર સેવા અને વ્યવસાય ચલાવતાં સાહસો રૂ. 10 લાખ સુધી ઉપકરણોમાં રોકાણ સાથે. |
| ☐ શિક્ષણ | : | |

કૃષિલક્ષી જમીનની વિગતો

જમીનની વિગતો: હું/અમે _____ ખાતે _____ એકર જમીનની માલિકી ધરાવીએ છીએ/વાપતર કરીએ છીએ જેનો 7/12નો દસ્તાવેજ/જમીનની મહેસૂલી રસીદ આની સાથે જોડેલ છે.

DNC

જેવી તમારી ઇચ્છા

(એકાઉન્ટ ખોલાવવાના કોર્મ અથવા એપ્લિકેશન સાથે જોડવું અને અલગથી ન મોકલવું)

HDFC બેન્ક ખાતે અમે નિરંતર તમારી જરૂરિયાતોને સમજવાનો અને તમને વધુ સારી સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ. તેથી અમે તમને અમારી અપડેટ કરેલી વિવિધ પ્રોડક્સ અને સેવાઓ અંગે કમ્યુનિકેશનના વિવિધ માધ્યમો દ્વારા માહિતગાર રાખીએ છીએ. પરંતુ ચોક્કસપણે, આખરે તો તમારી જ ઇચ્છા ચાલશે.

જો તમે કોઈપણ માર્કેટિંગ કમ્યુનિકેશન (ઇમેલ/SMS/ટેલિફોનિંગ) મેળવવા માંગતા ન હોવ તો, નીચેનું ફોર્મ ભરો.

નામ: _____ પ્રથમ નામ _____ પિતા/પતિનું નામ _____ અટક _____ સહી: _____
શહેર: _____ પિન: _____ તારીખ: _____

તમારી પસંદગીઓ અમારી સાથે શેર કરવા બદલ આભાર.

નિયમો અને શરતો: ● તમને તમારા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને અન્ય મહત્વપૂર્ણ સલાહો તેમજ તમારા એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી મળવાનું ચાલુ રહેશે. માત્ર પ્રદાન કરવામાં આવેલા ફોન/મોબાઇલ નંબર/ઇમેલ આઈડીને માત્ર અમારી માર્કેટિંગની ધાર્મિકી હેતુઓમાં આવશે. ● હું/અમે નોંધી લેશે કે, ઓફિસ/કોર્પોરેટ બોર્ડ નંબરને “ડુ નોટ કોલ” રજિસ્ટર કરવામાં આવ્યો નથી. ● તેમજ, “ડુ નોટ કોલ” તમારી રજિસ્ટ્રેશનની વિનંતી માટે તમને અમાર તરફથી કોલ આવી શકે છે. ● આ વિનંતી પર અમે ખગલાં લઈ શકીએ તે માટે હું/અમે અમને વિનંતી પ્રાપ્ત થાય ત્યારથી 45 દિવસનો સમય આપો

માત્ર બેન્કના ઉપયોગ માટે

સોર્સિંગ બ્રાન્ચનું નામ: _____
બ્રાન્ચનો કોડ: _____ PBનો કોડ: _____ PBની સહી _____

વધુ સહાયતા માટે, કૃપા કર અને અમને support@hdfcbank.com પર ઇમેઇલ મોકલો

પેટા સોત

- | | | | |
|---|--|--|---|
| ☐ LTS : LTS બ્રાન્ચ લીડ્સ | ☐ TEL : ટેલિસેલ્સ ટીમ દ્વારા જનરેટ કરવામાં આવેલી લીડ્સ | ☐ NET : નેટ બેનિફિટ લીડ્સ | ☐ CLK : ક્લિક કેસ |
| ☐ OPN : ઓપન માર્કેટ | ☐ PBK : PBK યુનિટ દ્વારા જનરેટ કરવામાં આવેલી લીડ્સ | ☐ NCQ : નોન કેડિટ ક્વોલિફાઇડ | ☐ BBZ : બેન્ક બઝાર લીડ્સ |
| ☐ XSL : અન્ય વર્ટિકલ્સ તરફથી કોસ સેલ | ☐ INW : આંતરિક વેબસાઇટ મારફતે જનરેટ કરવામાં આવેલી લીડ્સ | ☐ COP : કોલ ઉપર ક્લાસિક | ☐ OTH : અન્ય |
| ☐ ATM : ATM મારફતે લીડ્સ | ☐ ENW : બાહ્ય વેબસાઇટ મારફતે લીડ્સ | ☐ EML : ઇ-મેઇલ કેમ્પેઇન લીડ્સ | |
| ☐ SMS : મોબાઇલ મારફતે | ☐ CCP : કેડિટ કાર્ડ પ્રોગ્રામ | ☐ CHT : વેબ ચેટ લીડ્સ | |

સ્વીકૃતિ સ્લિપ

અરજદારનું નામ _____
અરજીની તારીખ _____ બ્રાન્ચ કોડ _____
HDFC બેન્ક ખાતે સંપર્કની વ્યક્તિ _____

તમારી અરજીની સ્થિતિ જાણવા માટે ઉપર પૂરા પાડવામાં આવેલા નંબર ઉપર કૃપા કરીને તમારા સંપર્ક વ્યક્તિને કોલ કરો. તમે નીચે આપેલા નંબર પર કોલ બેનિફિટ ફ્રી કરી શકો છો અથવા અરજી નંબરનો ઉલ્લેખ કરીને loansupport@hdfcbank.comને પણ લખી શકો છો.

6160616 મુંબઈ/દિલ્હી/NCR/બેંગલોર/ચેન્નાઈ/દેહરાદાદ/અમદાવાદ/પૂણે/કોલકાતા માટે અને 6160616 ચૌદાગ/જયપુર/લખનઉ/ઈન્દોર/કોચિન/પટના/બિહાર/ઝારખંડ માટે.

પ્રાપ્તિની તારીખ અને સમય: _____
બેન્કનો સ્ટેમ્પ/હસ્તાક્ષર: _____
સંપર્ક નંબર _____

અરજદારની ધીરાણ પરત કરવાની સમતાના મૂલ્યાંકનના એકમાત્ર હેતુ માટે બેન્ક દ્વારા જરૂરી તમામ અને કોઈ વધારાની માહિતી અરજદાર પૂરી પાડે તે શરતને આધીન તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રાપ્ત થયાના કામકાજના 10 દિવસોની અંદર અરજીની સ્થિતિ અંગે જાણકારી મળશે.



Sr. No.:

સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ (એકશર HDFC બેન્ક લિમિટેડના પ્રતિનિધી દ્વારા હસ્તાક્ષર કરવાનું છે.)

પ્રિય ગ્રાહક

HDFC બેન્ક લિમિટેડ વતી નીચે ઉલ્લેખિત દસ્તાવેજો સાથે HDFC બેન્ક લિમિટેડ માટે તમારી અરજીનું ફોર્મ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરવામાં આવે છે.



મંજૂરી પહેલાના દસ્તાવેજો	ટિક કરો	તારીખ	
અરજી ફોર્મ			ફોઈ પૂછપરછ/સ્પષ્ટતા માટે કૃપા કરીને સંપર્ક કરો
ફોટોગ્રાફ (આડા હસ્તાક્ષર કરેલો)			
6 માસનું તાજેતરનું બેન્ક સ્ટેટમેન્ટ			
આવક/પ્રમાણિત નાણાકીય વિગતોની ગણતરી ધરાવતું છેલ્લા 2 વર્ષનું ITR			પર (સેલ નંબર)
બોર્ડ ઠરાવ/ભાગીદારી કરાર/દસ્તાવેજીકરણ પત્ર			
ટર્નઓવરનો પુરાવો (તાજેતરનું વેચાણ/સર્વિસ ટેક્સ રિટર્ન)			
સાતત્ય પુરાવો/વ્યવસાય સાતત્ય પુરાવો			અથવા મારા સાથીને (બેક ઓફિસ) આભાર.
ઓળખનો પુરાવો (સ્પષ્ટ કરો)			
રહેણાંકનો પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓફિસ માલિકીનો પુરાવો (સ્પષ્ટ કરો)			પ્રતિ (DSA નામ)
લાયકાતનો પુરાવો (સ્પષ્ટ કરો)			
લોન પુનઃચુકવણી ટ્રેક રેકૉર્ડ			
અન્ય દસ્તાવેજો			(DSE નામ)
બિઝનેસ લોન ડ્રોપલાઈન ઓવરડ્રાફ્ટ સમજૂતી			
હસ્તાક્ષર પ્રમાણીકરણ			
ECS/ઓટો ડેબિટ મેન્ડેટ			(DSE નામ)
તારીખ વગરનો ચેક (સંખ્યા)			
પોસ્ટ ડેટેડ ચેક (સંખ્યા)			
અન્ય			

મહત્વપૂર્ણ નોંધ: કૃપા કરીને આ લોન અરજીના સંબંધમાં એક્ઝિક્યુટિવને રોકડ, ધારણકર્તા ચેક અથવા કોઈપણ પ્રકારની ચુકવણી કરશો નહીં.

કૃપા કરીને

નોંધી લેશો કે:

- લોન માટે તમારા અરજી ફોર્મ મળવાની બાબત HDFC બેન્ક લિમિટેડ દ્વારા તમારા લોનની આપોઆપ મંજૂરીનું સૂચન કરતી નથી.
- HDFC બેન્ક લિમિટેડ એકમાત્ર પોતાની વિવેકબુક્કીને આધીન લોનનું પ્રમાણ નિર્ધારિત કરશે.
- HDFC બેન્ક લિમિટેડ કોઈપણ કારણો આપ્યા વગર કોઈપણ અરજી નકારવાનો અધિકાર અબાધિત રાખે છે.
- HDFC બેન્ક લિમિટેડ અરજદારના સંબંધમાં મેળવવામાં આવેલા દસ્તાવેજો સિવાય વધારાના દસ્તાવેજ પૂરા પાડવા વિનંતી કરી શકે છે.
- HDFC બેન્ક લિમિટેડ અરજી ફોર્મની સાથે જમા કરાવવામાં આવેલા ફોટોગ્રાફ અને દસ્તાવેજો જાળવવાનો અધિકાર અબાધિત રાખે છે અને અરજદારને તે પરત કરવામાં આવશે નહીં.
- HDFC બેન્ક લિમિટેડ દસ્તાવેજની પ્રાપ્તિમાં નુકસાન અથવા વિલંબ માટે જવાબદાર ઠરશે નહીં.
- અપૂર્ણ/ ખામીયુક્ત અરજીઓ ઉપર પ્રક્રિયા કરવામાં આવશે નહીં અને HDFC બેન્ક લિમિટેડ વિલંબ અથવા અન્ય કોઈપણ બાબત માટે કોઈપણ રીતે જવાબદાર ઠરશે નહીં.
- ભવિષ્યની તારીખના અને તારીખ વગરના તમામ ચેકો માત્ર HDFC બેન્ક લિમિટેડની તરફેણમાં જ ઇસ્તુ કરવાના રહેશે.

સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ (એકશર HDFC બેન્ક લિમિટેડના પ્રતિનિધી દ્વારા હસ્તાક્ષર કરવાનું છે.)

પ્રિય ગ્રાહક

HDFC બેન્ક લિમિટેડ વતી નીચે ઉલ્લેખિત દસ્તાવેજો સાથે HDFC બેન્ક લિમિટેડ માટે તમારી અરજીનું ફોર્મ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરવામાં આવે છે.



મંજૂરી પહેલાના દસ્તાવેજો	ટિક કરો	તારીખ	
અરજી ફોર્મ			ફોઈ પૂછપરછ/સ્પષ્ટતા માટે કૃપા કરીને સંપર્ક કરો
ફોટોગ્રાફ (આડા હસ્તાક્ષર કરેલો)			
6 માસનું તાજેતરનું બેન્ક સ્ટેટમેન્ટ			
આવક/પ્રમાણિત નાણાકીય વિગતોની ગણતરી ધરાવતું છેલ્લા 2 વર્ષનું ITR			પર (સેલ નંબર)
બોર્ડ ઠરાવ/ભાગીદારી કરાર/દસ્તાવેજીકરણ પત્ર			
ટર્નઓવરનો પુરાવો (તાજેતરનું વેચાણ/સર્વિસ ટેક્સ રિટર્ન)			
સાતત્ય પુરાવો/વ્યવસાય સાતત્ય પુરાવો			અથવા મારા સાથીને (બેક ઓફિસ) આભાર.
ઓળખનો પુરાવો (સ્પષ્ટ કરો)			
રહેણાંકનો પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓફિસ માલિકીનો પુરાવો (સ્પષ્ટ કરો)			પ્રતિ (DSA નામ)
લાયકાતનો પુરાવો (સ્પષ્ટ કરો)			
લોન પુનઃચુકવણી ટ્રેક રેકૉર્ડ			
અન્ય દસ્તાવેજો			(DSE નામ)
બિઝનેસ લોન ડ્રોપલાઈન ઓવરડ્રાફ્ટ સમજૂતી			
હસ્તાક્ષર પ્રમાણીકરણ			
ECS/ઓટો ડેબિટ મેન્ડેટ			(DSE નામ)
તારીખ વગરનો ચેક (સંખ્યા)			
પોસ્ટ ડેટેડ ચેક (સંખ્યા)			
અન્ય			

મહત્વપૂર્ણ નોંધ: કૃપા કરીને આ લોન અરજીના સંબંધમાં એક્ઝિક્યુટિવને રોકડ, ધારણકર્તા ચેક અથવા કોઈપણ પ્રકારની ચુકવણી કરશો નહીં.

કૃપા કરીને

નોંધી લેશો કે:

- લોન માટે તમારા અરજી ફોર્મ મળવાની બાબત HDFC બેન્ક લિમિટેડ દ્વારા તમારા લોનની આપોઆપ મંજૂરીનું સૂચન કરતી નથી.
- HDFC બેન્ક લિમિટેડ એકમાત્ર પોતાની વિવેકબુક્કીને આધીન લોનનું પ્રમાણ નિર્ધારિત કરશે.
- HDFC બેન્ક લિમિટેડ કોઈપણ કારણો આપ્યા વગર કોઈપણ અરજી નકારવાનો અધિકાર અબાધિત રાખે છે.
- HDFC બેન્ક લિમિટેડ અરજદારના સંબંધમાં મેળવવામાં આવેલા દસ્તાવેજો સિવાય વધારાના દસ્તાવેજ પૂરા પાડવા વિનંતી કરી શકે છે.
- HDFC બેન્ક લિમિટેડ અરજી ફોર્મની સાથે જમા કરાવવામાં આવેલા ફોટોગ્રાફ અને દસ્તાવેજો જાળવવાનો અધિકાર અબાધિત રાખે છે અને અરજદારને તે પરત કરવામાં આવશે નહીં.
- HDFC બેન્ક લિમિટેડ દસ્તાવેજની પ્રાપ્તિમાં નુકસાન અથવા વિલંબ માટે જવાબદાર ઠરશે નહીં.
- અપૂર્ણ/ ખામીયુક્ત અરજીઓ ઉપર પ્રક્રિયા કરવામાં આવશે નહીં અને HDFC બેન્ક લિમિટેડ વિલંબ અથવા અન્ય કોઈપણ બાબત માટે કોઈપણ રીતે જવાબદાર ઠરશે નહીં.
- ભવિષ્યની તારીખના અને તારીખ વગરના તમામ ચેકો માત્ર HDFC બેન્ક લિમિટેડની તરફેણમાં જ ઇસ્તુ કરવાના રહેશે.

હું/અમે પુષ્ટિ કરીએ છીએ કે મારી પાસેથી અરજી/દસ્તાવેજ એકત્રિત કરનારા એક્ટ્રિક્યુટિવે:

- મને/અમને જણાવ્યું છે કે લાગુ પડતાં વ્યાજ દરો માસિક બાકી ધોરણે વાર્ષિક ગણવામાં આવે છે.
- બેન્ક યોગ્ય ગણે તેવી પ્રોસેસિંગ ફી (નોન-રિસ્કોબલ) લોન અરજી માટે વસૂલવામાં આવશે.
- તેણે મારી/અમારી પાસેથી આ લોન અરજીની સાથે અથવા તે સંબંધમાં કોઈ રોકડ, ધારણકર્તા ચેક અથવા કોઈ પ્રકારની ચુકવણી મેળવી નથી.
- મને/અમને જાણકારી આપી છે કે લોનના સંબંધમાં લાગુ પડે તે સર્વિસ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.
- મને/અમને જાણકારી આપી છે કે અદ્યત્ન/ખામીયુક્ત અરજી ઉપર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં અને HDFC બેન્ક લિમિટેડ તેના પરિણામે ઉદભવતાં વિલંબ અથવા અન્ય બાબત માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
- મને/અમને જાણકારી આપી છે કે દસ્તાવેજો/ફોટોગ્રાફ એકવખત HDFC બેન્ક લિમિટેડ પાસે જમા કરાવી દીધા બાદ કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
- મને/અમને જાણકારી આપી છે કે અરજીની મંજૂરી એકમાત્ર HDFC બેન્ક લિમિટેડની વિવેકબુટ્ટીને આધીન છે.
- મને/અમને જાણકારી આપી છે કે લોનનું પ્રમાણ આખરે HDFC બેન્ક લિમિટેડ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે અને તેના માટે મને/અમને કોઈ વચન આપવામાં આવ્યું નથી.
- મને/અમને જાણકારી આપી છે કે સુવિધા શરૂ થવાની તારીખથી પ્રથમ 6 માસની અંદર સુવિધાના પ્રી-ક્લોઝર માટે પરવાનગી નથી.
- મને/અમને જાણકારી આપી છે કે કથિત 6 માસના સમયગાળા બાદ સુવિધાના પ્રી-ક્લોઝર માટે આવી તારીખે લાગુ પડતી ઓપરેટિંગ ઓવરડ્રાફ્ટ લિમિટ ઉપર 4%નો ચાર્જ વસૂલવામાં આવશે.
- મને/અમને જાણકારી આપી છે કે સમગ્ર સુવિધાના સમયગાળા દરમિયાન સુવિધાની આંશિક સમાપ્તિ માટે પરવાનગી નથી.
- ડુવેલિંગેટ નો કસુ સર્ટિફિકેટ/NOC માટે ચાર્જિસ રૂ. 250/- છે. ચુકવવામાં નહીં આવેલી રકમ (સુવિધાની ઓપરેટિંગ મર્યાદા કરતાં વધારાનો મુખ્ય ચુકવવાપાત્ર બાકી રકમનો હિસ્સાની સાથે અન્ય ચુકવવામાં નહીં આવેલા બાકી રકમ) નાદારી, ચેક/ SI/ ECS રિટર્ન ચાર્જિસની તારીખથી બાકી રહેતી રકમ ઉપર % છે (અરવીક્રુટિ બદલ બેન્કના દીવાની અને ફોજદારી અધિકારો અને ઉપાયોને વિપરિત અસર થયા વગર): 550/- પૂર્વ પ્રસંગ, કાનૂની અને પ્રાસંગિક ચાર્જિસ વાસ્તવિક થાય તે મુજબ. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય વૈધાનિક ચાર્જિસ રાજ્યના લાગુ પડતાં કાયદા મુજબ.
- હું/અમે સમજીએ છીએ કે HDFC બેન્ક લિમિટેડ લોન અરજીમાં મારા/અમારા ઉદ્દેશ કરવામાં આવેલા ઇ-મેઈલ ID ઉપર મને/અમને વેલકમ લેટર મોકલશે.
- મને/અમને જાણકારી આપી છે કે વેલકમ લેટર અને પુનઃચુકવણી અનુસૂચી www.hdfcbank.com ઉપર પણ ઉપલબ્ધ છે અને "નેટ બેન્કિંગ લોગિન પેજ"માં નોંધણી પ્રક્રિયા વિગતવાર સમજાવી છે.
- હું/અમે જો જરૂર હોય તો વેલકમ લેટર અને પુનઃચુકવણી અનુસૂચીની ભૌતિક નકલ માટે વિનંતી કરી શકું છું.

મંજૂરી પહેલાના દસ્તાવેજો	ટિક કરો	તારીખ	DSA નામ
અરજી ફોર્મ			
ફોટોગ્રાફ (હસ્તાક્ષર કરેલો)			
તાજેતરનું 6 માસનું બેન્ક સ્ટેટમેન્ટ			DSA કોડ
આવક /પ્રમાણિત નાણાકીય વિગતોની ગણતરી ધરાવતું છેદા 2 વર્ષનું ITR			
બોર્ડ ઠરાવ/ ભાગીદારી કરાર/ દસ્તાવેજીકરણ પત્ર			
ટર્નઓવરનો પુરાવો (તાજેતરનું વેચાણ / સર્વિસ ટેક્સ રિટર્ન)			DSA ટેલિફોન નંબર
વર્તમાન નોકરી પર સાતત્ય પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓળખનો પુરાવો (સ્પષ્ટ કરો)			
રહેણાંકનો પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓફિસનો પુરાવો (સ્પષ્ટ કરો)			DSE કોડ
લાયકાતનો પુરાવો (સ્પષ્ટ કરો)			
નેલેન્સ ટ્રાન્સફર / નેલેન્સ ટ્રાન્સફર અને ટોપ અપ/ પુનઃચુકવણી/ રિટેન્શન કિસ્સાઓ માટે લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ			
અન્ય દસ્તાવેજો			સેલ્સ એક્ટ્રિક્યુટિવનું નામ
બિઝનેસ લોન ડ્રોપલાઈન ઓવરડ્રાફ્ટ સમજૂતી			
હસ્તાક્ષર પ્રમાણીકરણ			
ECS/ઓટો ડેબિટ મેન્ડેટ			એક્ટ્રિક્યુટિવનું નામ
અપડેટેડ ચેક (સંખ્યા)			જેણે અરજદારનો સંપર્ક કર્યો હતો.
પોસ્ટ ડેટેડ ચેક (સંખ્યા)			

અરજદારનું નામ _____ અરજદારના હસ્તાક્ષર _____ તારીખ _____

હું/અમે પુષ્ટિ કરીએ છીએ કે મારી પાસેથી અરજી/દસ્તાવેજ એકત્રિત કરનારા એક્ટ્રિક્યુટિવે:

- મને/અમને જણાવ્યું છે કે લાગુ પડતાં વ્યાજ દરો માસિક બાકી ધોરણે વાર્ષિક ગણવામાં આવે છે.
- બેન્ક યોગ્ય ગણે તેવી પ્રોસેસિંગ ફી (નોન-રિસ્કોબલ) લોન અરજી માટે વસૂલવામાં આવશે.
- તેણે મારી/અમારી પાસેથી આ લોન અરજીની સાથે અથવા તે સંબંધમાં કોઈ રોકડ, ધારણકર્તા ચેક અથવા કોઈ પ્રકારની ચુકવણી મેળવી નથી.
- મને/અમને જાણકારી આપી છે કે લોનના સંબંધમાં લાગુ પડે તે સર્વિસ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.
- મને/અમને જાણકારી આપી છે કે અદ્યત્ન/ખામીયુક્ત અરજી ઉપર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં અને HDFC બેન્ક લિમિટેડ તેના પરિણામે ઉદભવતાં વિલંબ અથવા અન્ય બાબત માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
- મને/અમને જાણકારી આપી છે કે દસ્તાવેજો/ફોટોગ્રાફ એકવખત HDFC બેન્ક લિમિટેડ પાસે જમા કરાવી દીધા બાદ કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
- મને/અમને જાણકારી આપી છે કે અરજીની મંજૂરી એકમાત્ર HDFC બેન્ક લિમિટેડની વિવેકબુટ્ટીને આધીન છે.
- મને/અમને જાણકારી આપી છે કે લોનનું પ્રમાણ આખરે HDFC બેન્ક લિમિટેડ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે અને તેના માટે મને/અમને કોઈ વચન આપવામાં આવ્યું નથી.
- મને/અમને જાણકારી આપી છે કે સુવિધા શરૂ થવાની તારીખથી પ્રથમ 6 માસની અંદર સુવિધાના પ્રી-ક્લોઝર માટે પરવાનગી નથી.
- મને/અમને જાણકારી આપી છે કે કથિત 6 માસના સમયગાળા બાદ સુવિધાના પ્રી-ક્લોઝર માટે આવી તારીખે લાગુ પડતી ઓપરેટિંગ ઓવરડ્રાફ્ટ લિમિટ ઉપર 4%નો ચાર્જ વસૂલવામાં આવશે.
- મને/અમને જાણકારી આપી છે કે સમગ્ર સુવિધાના સમયગાળા દરમિયાન સુવિધાની આંશિક સમાપ્તિ માટે પરવાનગી નથી.
- ડુવેલિંગેટ નો કસુ સર્ટિફિકેટ/NOC માટે ચાર્જિસ રૂ. 250/- છે. ચુકવવામાં નહીં આવેલી રકમ (સુવિધાની ઓપરેટિંગ મર્યાદા કરતાં વધારાનો મુખ્ય ચુકવવાપાત્ર બાકી રકમનો હિસ્સાની સાથે અન્ય ચુકવવામાં નહીં આવેલા બાકી રકમ) નાદારી, ચેક/ SI/ ECS રિટર્ન ચાર્જિસની તારીખથી બાકી રહેતી રકમ ઉપર % છે (અરવીક્રુટિ બદલ બેન્કના દીવાની અને ફોજદારી અધિકારો અને ઉપાયોને વિપરિત અસર થયા વગર): 550/- પૂર્વ પ્રસંગ, કાનૂની અને પ્રાસંગિક ચાર્જિસ વાસ્તવિક થાય તે મુજબ. સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય વૈધાનિક ચાર્જિસ રાજ્યના લાગુ પડતાં કાયદા મુજબ.
- હું/અમે સમજીએ છીએ કે HDFC બેન્ક લિમિટેડ લોન અરજીમાં મારા/અમારા ઉદ્દેશ કરવામાં આવેલા ઇ-મેઈલ ID ઉપર મને/અમને વેલકમ લેટર મોકલશે.
- મને/અમને જાણકારી આપી છે કે વેલકમ લેટર અને પુનઃચુકવણી અનુસૂચી www.hdfcbank.com ઉપર પણ ઉપલબ્ધ છે અને "નેટ બેન્કિંગ લોગિન પેજ"માં નોંધણી પ્રક્રિયા વિગતવાર સમજાવી છે.
- હું/અમે જો જરૂર હોય તો વેલકમ લેટર અને પુનઃચુકવણી અનુસૂચીની ભૌતિક નકલ માટે વિનંતી કરી શકું છું.

મંજૂરી પહેલાના દસ્તાવેજો	ટિક કરો	તારીખ	DSA નામ
અરજી ફોર્મ			
ફોટોગ્રાફ (હસ્તાક્ષર કરેલો)			
તાજેતરનું 6 માસનું બેન્ક સ્ટેટમેન્ટ			DSA કોડ
આવક /પ્રમાણિત નાણાકીય વિગતોની ગણતરી ધરાવતું છેદા 2 વર્ષનું ITR			
બોર્ડ ઠરાવ/ ભાગીદારી કરાર/ દસ્તાવેજીકરણ પત્ર			
ટર્નઓવરનો પુરાવો (તાજેતરનું વેચાણ / સર્વિસ ટેક્સ રિટર્ન)			DSA ટેલિફોન નંબર
વર્તમાન નોકરી પર સાતત્ય પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓળખનો પુરાવો (સ્પષ્ટ કરો)			
રહેણાંકનો પુરાવો (સ્પષ્ટ કરો)			
ઓફિસનો પુરાવો (સ્પષ્ટ કરો)			DSE કોડ
લાયકાતનો પુરાવો (સ્પષ્ટ કરો)			
નેલેન્સ ટ્રાન્સફર / નેલેન્સ ટ્રાન્સફર અને ટોપ અપ/ પુનઃચુકવણી/ રિટેન્શન કિસ્સાઓ માટે લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ			
અન્ય દસ્તાવેજો			સેલ્સ એક્ટ્રિક્યુટિવનું નામ
બિઝનેસ લોન ડ્રોપલાઈન ઓવરડ્રાફ્ટ સમજૂતી			
હસ્તાક્ષર પ્રમાણીકરણ			
ECS/ઓટો ડેબિટ મેન્ડેટ			એક્ટ્રિક્યુટિવનું નામ
અપડેટેડ ચેક (સંખ્યા)			જેણે અરજદારનો સંપર્ક કર્યો હતો.
પોસ્ટ ડેટેડ ચેક (સંખ્યા)			

અરજદારનું નામ _____ અરજદારના હસ્તાક્ષર _____ તારીખ _____